

એપ્રિલ-2021

પરિષદવૃત્ત

સંકલન : કીર્તિદા શાહ

આજીવનસભ્યમિત્રો,
નમસ્તે,

સાહિત્ય પરિષદના ચી. મં. ગ્રંથાલયના સ્થાપના દિવસની ઉજવણી તા.17-03-2021ના રોજ થઈ. ઉજવણીના ભાગરૂપે ચીમનલાલ મંગળદાસનો ફોટો ગ્રંથાલયમાં મૂકવામાં આવ્યો. પરિષદપ્રમુખ અને ચીમનલાલ મંગળદાસના કુટુંબીજનોએ ફોટાની અનાવરણવિધિ કરી. આ પ્રસંગે શ્રીમતી માયાબહેન અને શ્રી વિપુલ આચાર્યએ કવિશ્રી જયંત પાઠક અને ઉસનસની કવિતા સંદર્ભે સતીશ વ્યાસ અને યોગેશ જોશીના મનનીય પ્રવચનો થયા.

જેમનું નામ ગ્રંથાલય સાથે જોડાયેલું છે તે ચીમનલાલ મંગળદાસના કુટુંબીજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં અને ગ્રંથાલયના દુર્લભ પુસ્તકોનું ડિજિટલાઈસ કરવા માટે રૂ.7.50 લાખની સખાવત કરી. સખાવત કરનારા ચીમનલાલ મંગળદાસના કુટુંબીજનો પ્રત્યે પરિષદ આભારની લાગણી વ્યક્ત કરે છે. ગ્રંથાલયમંત્રીશ્રીના ઉત્સાહ અને મહેનતથી કાર્યક્રમ દીપી ઊઠ્યો.

પરિષદના ઉપક્રમે વિકાસમંત્રીશ્રીએ તા.28-3-21ના રોજ 'વાર્તા રે વાર્તા' શીર્ષકથી ઓનલાઈન એક કાર્યક્રમનું આયોજન કર્યું. આ ઝૂમ કાર્યક્રમનું સરસ સંચાલન શ્રી નરેશ કાપડિયાએ કર્યું. વાર્તાકાર યોગેશ જોશી અને કુમાર જૈમિની શાસ્ત્રીની વાર્તાઓનું કર્ણપ્રિય પઠન શ્રી નરેશ કાપડિયાએ અને શ્રી યામિની વ્યાસે કર્યું. પછી બંને સર્જકે પોતાની કેફિયત રજૂ કરી. ઘણાં રસિક મિત્રોએ આ ઝૂમ કાર્યક્રમનો લાભ લીધો.

વિકાસમંત્રીશ્રીના પ્રયત્નોથી પરિષદને બે વ્યાખ્યાનમાળાઓ માટે દાન મળ્યા. (1) નાટ્યકાર દિલીપ મોદી સ્મૃતિ વ્યાખ્યાનમાળા માટે 1,50,000નું દાન, (2) નાટ્યકાર સ્વ. અનંગ મહેતા સ્મૃતિ વ્યાખ્યાનમાળા માટે ૨,૦૦,૦૦૦નું દાન. પરિષદને વ્યાખ્યાનમાળા માટે દાન આપનારા શ્રીમાન દિલીપ મોદી અને શ્રીમાન સ્વ. અનંત મહેતાના કુટુંબીજનો પ્રત્યે પરિષદ આભારની લાગણી વ્યક્ત કરે છે.

નવા આજીવન સભ્યપદ માટે પરિષદે ફી વધારો કરવાની તારીખ 30 જૂન સુધી લંબાવી છે. 30 જૂન સુધી આજીવન સભ્ય ફી રૂ. 2000/- અંકે રૂ. બે હજાર રહેશે. સંસ્થાસભ્ય ફી રૂ. 5000 રહેશે. 30 જૂન પછી આજીવન સભ્યપદ માટે રૂ. 3000 થશે.

આજીવન સભ્યપદ માટેના સુધારણા ફોર્મમાં સભ્યો આધારકાર્ડ/પાનકાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ રજૂ કરી શકશે.

પરદેશમાં વસતા આજીવન સભ્યોએ તેમની ઓળખ માટે પાસપોર્ટના પ્રથમ અને અંતિમ પૃષ્ઠની ઝેરોક્ષ મોકલવાની રહેશે. આજીવન સભ્યપદ સુધારણાનું ફોર્મ મોકલવાની તારીખ 30 જૂન કરવામાં આવી છે.

મિત્રો, સૌને સાદર વિનંતી છે કે આપ સૌ આપનું આજીવન સભ્યપદ સુધારણાનું ફોર્મ સત્વરે માંગ્યા પ્રમાણેની સઘળી વિગત ભરીને મોકલશો.

આપ સૌ હાર્ડકોપીમાં ફોર્મ મોકલશો. તો કામ કરવામાં સરળતા થશે. પરંતુ એ અનુકૂળ ન થાય તો આપ આપનું ફોર્મ ભરીને પરિષદ પર અહીં દર્શાવેલ આઈ. ડી. પર મેઈલ કરશો.

મેઈલ આઈ. ડી. – gspamd123@gmail.com, - parabgsp@gmail.com

અથવા

અહીં દર્શાવેલ મોબાઈલ નં. પર વોટ્સએપ કરશો.

ચન્દ્રકાંત ભાવસાર (મો. નં. 97732 22425, 95379 71073)